




 **AstroSage**

World's No. 1 Astrology Portal & App

Year Book

Your Personalized 12 Months Horoscope

Table of Contents

Pooja Sharma	5
એસ્ટ્રોસોજ વાર્ષિક પુસ્તક માં તમને શું મળશે.	6
આવતા ૧૨ મહિના માટે મહત્વ ના જ્યોતિષીય બિંદુઓ	7
આવતા ૧૨ મહિના માટે સટીક ઉપાયો	8
આવતા ૧૨ મહિના માટે વિશેષ	8
આવતા ૧૨ મહિના માટે વિસ્તૃત વિશ્લેષણ	9
એપ્રિલ 14, 2025 - જૂન 11, 2025	10
આર્થિક જીવન	10
કારકિર્દી	10
પારિવારિક જીવન	10
વિવાહિત અને પ્રેમ જીવન	10
આરોગ્ય	10
આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ	10
જૂન 11, 2025 - ઓગસ્ટ 02, 2025	11
આર્થિક જીવન	11
કારકિર્દી	11
પારિવારિક જીવન	11
વિવાહિત અને પ્રેમ જીવન	11
આરોગ્ય	11
આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ	11
ઓગસ્ટ 02, 2025 - ઓગસ્ટ 23, 2025	12
આર્થિક જીવન	12
કારકિર્દી	12
પારિવારિક જીવન	12
વિવાહિત અને પ્રેમ જીવન	12
આરોગ્ય	12
આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ	12
ઓગસ્ટ 23, 2025 - સપ્ટેમ્બર 11, 2025	13
આર્થિક જીવન	13
કારકિર્દી	13

પારિવારિક જીવન	13
વિવાહિત અને પ્રેમ જીવન	13
આરોગ્ય	13
આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ	13
સપ્ટેમ્બર 11, 2025 - ઑક્ટોબર 11, 2025	14
આર્થિક જીવન	14
કારકિર્દી	14
પારિવારિક જીવન	14
વિવાહિત અને પ્રેમ જીવન	14
આરોગ્ય	14
આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ	14
ઑક્ટોબર 11, 2025 - નવેમ્બર 01, 2025	15
આર્થિક જીવન	15
કારકિર્દી	15
પારિવારિક જીવન	15
વિવાહિત અને પ્રેમ જીવન	15
આરોગ્ય	15
આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ	15
નવેમ્બર 01, 2025 - ડિસેમ્બર 26, 2025	16
આર્થિક જીવન	16
કારકિર્દી	16
પારિવારિક જીવન	16
વિવાહિત અને પ્રેમ જીવન	16
આરોગ્ય	16
આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ	16
ડિસેમ્બર 26, 2025 - ફેબ્રુઆરી 13, 2026	17
આર્થિક જીવન	17
કારકિર્દી	17
પારિવારિક જીવન	17
વિવાહિત અને પ્રેમ જીવન	17
આરોગ્ય	17
આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ	17
ફેબ્રુઆરી 13, 2026 - એપ્રિલ 11, 2026	18

આર્થિક જીવન	18
કારકિર્દી	18
પારિવારિક જીવન	18
વિવાહિત અને પ્રેમ જીવન	18
આરોગ્ય	18
આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ	18
એપ્રિલ 11, 2026 - જૂન 02, 2026	19
આર્થિક જીવન	19
કારકિર્દી	19
પારિવારિક જીવન	19
વિવાહિત અને પ્રેમ જીવન	19
આરોગ્ય	19
આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ	19
જૂન 02, 2026 - જૂન 23, 2026	20
આર્થિક જીવન	20
કારકિર્દી	20
પારિવારિક જીવન	20
વિવાહિત અને પ્રેમ જીવન	20
આરોગ્ય	20
આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ	20
જૂન 23, 2026 - ઓગસ્ટ 23, 2026	21
આર્થિક જીવન	21
કારકિર્દી	21
પારિવારિક જીવન	21
વિવાહિત અને પ્રેમ જીવન	21
આરોગ્ય	21
આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ	21
આવતા ૧૨ મહિનાઓ માં બનવાવાળા વિશેષ યોગો	22
આ અવધિ ની મજબૂતી	23

એક સારા ભવિષ્ય માટે

Pooja Sharma

ને સમર્પિત

એસ્ટ્રોસેજ વાર્ષિક પુસ્તક માં તમને શું મળશે.

અમે તમને ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્ય પસંદ કરવા બદલ આભાર વ્યક્ત કરીએ છે. એસ્ટ્રોસેજ વાર્ષિક પુસ્તક ની મદદ થી અમને યકીન છે કે આવતા ૧૨ મહિના તમારા મુકુટ માં મોરપીછ લગાડશે. આ માત્ર આશા ની કિરણ નહિ હોય, પરંતુ તમને પોતાની બધી સમસ્યાઓ નું નક્કર પૂર્વાનુમાન અને સરળ સમાધાન પણ આપશે.

એસ્ટ્રોસેજ વાર્ષિક પુસ્તક વૈદિક જ્યોતિષ ના પ્રાચીન સિદ્ધાંતો પર આધારિત છે. ચોર ના દૃષ્ટાંતોએ, પોતાની ધ્યાનમગ્ન અચેતન અવસ્થા માં, માનવ પીડા ને ઓછી કરવા માટે શોધ કરી અને ખીલવા ની જન્મજાત ક્ષમતા માં મદદ કરી. એજ વિજ્ઞાન નો ઉપયોગ કરી અમે આ વર્ષ ની પુસ્તક બનાવી છે, જેથી તમે પોતાની પુરી ક્ષમતા નો અનુભવ કરી શકો અને એનો ઉપયોગ કરી શકો, અને આવનારા ૧૨ મહિનાઓ માં સફળતા પ્રાપ્ત કરી શકો.

જેમ બ્રહ્માંડીય ઉર્જાઓ નો પ્રવાહ સમય સાથે બદલાયા કરે છે, તમે જોશો કે આવતા ૧૨ મહિનાઓ માં વિભિન્ન અવધિઓ દરમિયાન કઈ સ્થિતિઓ સહાયક અથવા કઠિન-પ્રબળ રહેશે. અને સિવાય તમે કરવા જેવા અને ના કરવા જેવા તથા એવા ખાડાઓ થી બચવાના ઉપાયો જાણશો જે તમારા વિકાસ ને બાધિત કરી શકે છે. અમે લોકો આ દરમિયાન તમારા જન્મક્ષર માં વિભિન્ન રાજ યોગો અને વિશેષ યોગો વિશ્લેષિત કરી ને પ્રસ્તુત કર્યા છે.

તમને આ બધા નું મૂળ આપવા માટે અમે એક અદ્વિતીય સૂચકાંક પણ વિકસિત કર્યો છે જે તમને આવતા ૧૨ મહિનાઓ ની તાકાત દેખાડે છે. બીજા શબ્દો માં કહીએ તો, વધારે તાકાત તમારી ક્ષમતા નો ઉપયોગ કરવા અને વાંછિત પરિણામ મેળવવા માટે સારી સંભાવના છે.

અમે માનીએ છે કે તમે એક અદ્વિત્ય માણસ છો એટલેજ એસ્ટ્રોસેજ વાર્ષિક પુસ્તક તમને ગહનતા થી વિશ્લેષણ, સટીક પૂર્વાનુમાન અને સરળતા થી અનુસરણ ના સુઝાવો આપશે જે વિશેષ રૂપ થી તમારા માટે બનેલા છે. વાર્ષિક પુસ્તક ની મદદ થી તમે તમારા જીવન ચક્ર માં સફળતા ની રાહ પર જશો, જેથી તમને સંતુષ્ટિ ખુશી, સફળતા અને માનસિક શાંતિ મળશે. અમારી સાથે આ અદ્ભુત યાત્રા માં અમે તમારું સ્વાગત કરીએ છે, જે આવનારા ૧૨ મહિનાઓ માં ખુશી અને સમૃદ્ધિ ની યાત્રા છે.

તમારા જન્મ ની વિગતો

જન્મ દિવસ: 23 : 8 : 1979

જન્મ સમય: 23 : 53 : 18

જન્મ સ્થાન: Delhi

ટાઈમ ઝોન: 5.5

અક્ષાંશ: 28 : 40 : N

દેશાંતર: 77 : 13 : E

આવતા ૧૨ મહિના માટે મહત્વ ના જ્યોતિષીય બિંદુઓ

પક્ષ ના બિંદુઓ

ભાગ્ય અંક:	2
સારા અંક:	2, 7, 9
ભાગ્ય દિવસ:	રવિવાર, મંગળવાર
સારા ગ્રહો:	ચંદ્ર, સૂર્ય, મંગળ
મિત્ર સૂચકો:	કર્ક, સિંહ, ધનુ
સારાં લગ્ન:	કર્ક, તુલા, ધનુ, કુમ્ભ
ભાગ્ય ધાતુ:	ગોલ્ડ
ભાગ્ય રત્ન:	નીલમ

વિપક્ષ ના બિંદુઓ

ખરાબ દિવસ:	શુક્રવાર
ખરાબ કરણ:	ચતુષ્પદ
ખરાબ લગ્ન:	સિંહ
શેતાન અંકો:	4, 8
ખરાબ મહિનો:	ફાગણ
ખરાબ નક્ષત્ર:	અશ્લેષા
ખરાબ પ્રહર:	4
ખરાબ રાશિ:	કુંભ
ખરાબ તિથિ:	5, 10, 15
ખરાબ યોગ:	વજ
ખરાબ ગ્રહો:	શુક્ર, બુધ

આવતા ૧૨ મહિના માટે સટીક ઉપાયો

વૈદિક જ્યોતિષવિદ્યા મુજબ ઉપચારાત્મક પગલાં આપણ ને આપણી સમસ્યાઓ માંથી છુટકારો મેળવવા અને આપણા જીવન માં હકારાત્મક ઊર્જા વધારવા માં મદદ કરે છે. દરેક સમયગાળો અનન્ય તકો અને પડકારો લાવે છે. આ દ્રષ્ટિકોણ થી, આ સમય ગાળો પણ અનન્ય બનશે. અહીં આપેલ ઉપાય તમને 12 મહિના માં મુશ્કેલ પરિસ્થિતિઓ માંથી બચાવશે અને તમારા નસીબ ને વધારવા માં સહાય કરશે. આ ઉપાય ૧૨ મહિના દરમિયાન કરી શકાય છે. તમારા માટે ઉપચારાત્મક ઉપાય છે:

આ મંત્ર નો દરરોજ જાપ કરો: ૐ નમ:શિવાય

આવતા ૧૨ મહિના માટે વિશેષ

આ સમય ગાળા માં ઘણા ફેરફારો છે - કેટલાક સુખદ બની રહ્યા છે, જ્યારે અન્ય તમારી ઇચ્છાઓ મુજબ હોઈ શકે નહીં. એક બાજુ, તમને આ સમયે ઘણી સિદ્ધિઓ મળશે. બીજી બાજુ, તમને ઘણી વાર ચકાસવા માં આવશે. તેથી, અમે તમારું ધ્યાન અમુક મહત્વપૂર્ણ વસ્તુઓ પર આકર્ષિત કરવા માંગીએ છીએ, જે તમને આ સમયગાળા દરમિયાન શરૂ થઈ બનવા માં અને તમને ખાડાઓ થી બચાવવા માં મદદ કરશે. આ સૂચનો તદ્દન મૂળભૂત હોઈ શકે છે, પરંતુ તેઓ ઊંડા અને લાંબા ગાળા ના અસરો ઉપજાવે છે. ચાલો કેટલાક મહત્વ ના પરિબલો પર ધ્યાન આપીએ કે તમારે ધ્યાન માં શું રાખવું જોઈએ:

કરવા જેવું

- માતા ની સંપૂર્ણ સંભાળ રાખો.
- પોતાનો આત્મા સમ્માન જાણવી રાખો.

ના કરવા જેવું

- પોતાના મલિક અથવા વરિષ્ઠ નું અપમાન ના કરો.
- એવા કોઈપણ કાર્ય માં ના પાડો જેથી સમાજ માં તમારી છવિ ખરાબ થાય.

આવતા ૧૨ મહિના માટે વિસ્તૃત વિશ્લેષણ

તમારા જીવન ને અસર કરતી સૂક્ષ્મ શક્તિ હંમેશાં પ્રવાહ માં રહે છે. તેથી, આગામી ૧૨ મહિના નું ઊંડાણપૂર્વક વિશ્લેષણ જીવન ના વિવિધ ક્ષેત્રો માં જુદા જુદા પરિણામો બતાવે છે. હવે, ચાલો આવનારા મહિનાઓ ના વિવિધ ભાગો કેવી રીતે પ્રભાવિત થાય છે તેના આધારે વિગતવાર ભવિષ્ય વાણી જોઈએ:

એપ્રિલ 14, 2025 - જૂન 11, 2025

આર્થિક જીવન

આ સમયે તમે નાણાકીય લાભ મેળવશો. તમને પૈસા મળશે અને તમે તમારી ખુશી વધારવા માટે તે પૈસા નો ઉપયોગ કરશો. આ સમયગાળા માં તમે ભૌતિક આનંદ માણશો. તમારી મિલકત માં પણ વૃદ્ધિ થવા ની શક્યતા છે. તમે પૈસા બચાવવા માટે વધુ ધ્યાન આપશો નહીં. પરિવાર આર્થિક લાભ પણ મેળવી શકે છે.

કારકિર્દી

તમારી કારકિર્દી માં નિષ્ફળતા નિરાશા જનક હોઈ શકે છે. આ સમયે તમારા દુશ્મનો પણ સક્રિય રહેશે. તેઓ તમારી છબી ને બગાડવા ની કોશિશ કરશે, તેથી સાવચેત રહો. આ ઉપરાંત, તમારા પર ખોટા આરોપો લાદવા માં આવી શકે છે. તમારી કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારી અસફળતા ને હથિયાર બનાવી આગળ વધો.

પારિવારિક જીવન

આ સમય દરમિયાન તમારા કૌટુંબિક જીવન માં સુખ નો અભાવ હોઈ શકે છે. કેટલાક કામ ના કારણે ઘર થી દૂર જવા ની શક્યતા છે. વ્યસ્ત કાર્ય ને લીધે, તમે તમારા કુટુંબ ને પૂરતો સમય આપી શકશો નહીં. પ્રસંગોપાત સ્થાનિક સમસ્યાઓ પણ તમારા તાણ માટે એક કારણ બની શકે છે.

વિવાહિત અને પ્રેમ જીવન

જીવનસાથી ને કારણે તમે લગ્ન જીવન માં સારા સમાચાર મેળવી શકો છો. કારકિર્દી માં જીવન ભાગીદાર ને લાભ થવા ની સંભાવના છે. બીજી બાજુ, તમે પણ તેમની પાસે થી દૂર જઈ શકો છો. પ્રેમ જીવન માટે પણ પડકાર રૂપ સમય બની શકે છે. પ્રિયજન સાથે ના સંબંધ માં મધુર બનવા નો પ્રયત્ન કરો.

આરોગ્ય

આ સમયે તમારી સ્વાસ્થ્ય ની કાળજી રાખો. જો તમે કોઈ રોગ થી પીડાતા હો તો સંપૂર્ણ કાળજી લો. જો તમારે ખોરાક ખાવા નું ટાળવું હોય તો ચોક્કસપણે ટાળજો નહીંતર બીમારી માં સુધારો કરવો મુશ્કેલ બનશે. દારૂ, વગેરે, નશીલી વસ્તુઓ નું ઉપયોગ ન કરો.

આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ

શું કરો

- તમારા પરિવાર ની સંભાળ રાખો અને તેમની જરૂરિયાતો ને પૂર્ણ કરો. તમારી પોતાની ભૂલો માં થી શીખવા નો પ્રયત્ન કરો.

શું ન કરો

- કુટુંબ માં માતા પિતા અથવા વડીલો ના સ્વાસ્થ્ય ને અવગણશો નહીં. ખૂબ રુદિચુસ્ત બનવા નો પ્રયાસ કરશો નહીં.

ઉપાય

- દરરોજ ખાવા માં થી, ખોરાક નો એક ભાગ ગાય ને એક ભાગ કૂતરા અને એક ભાગ કાગડા ને ખવડાવો. નિર્જન સ્થળે ભૂમિ માં કાળો સુરમો દબાવો.

જૂન 11, 2025 - ઓગસ્ટ 02, 2025

આર્થિક જીવન

તમે તમારી બુદ્ધિ થી તમારા વ્યવસાય અને નોકરી બંને માં થી પૈસા કમાશો. આ સમયગાળા દરમિયાન તમે મુસાફરી માં થી ચોક્કસપણે લાભ મેળવશો. જો આ સફર કામ ના સંબંધ માં હોય, તો પૈસા ફાયદાકારક રહેશે અને જો કુટુંબ મુસાફરી હોય તો, તો લોકો તેમને મળશે. નવમાં ઘર માં બુધ શુદ્ધ હોવા નું મનાય છે. આની અસર થી વ્યક્તિ નસીબદાર બને છે, તેથી આ સમયગાળા માં તમારી સાથે નસીબ આવશે. સારા નસીબ ને કારણે, નોકરી અથવા વ્યવસાય માં પ્રગતિ અને નફો થશે.

કારકિર્દી

અહીં બુદ્ધ પ્રભાવશાળી અવાજ અને વ્યક્તિત્વ પ્રદાન કરે છે, તેથી આ અવધિ માં તમે તમારી વાણી ને તમારા પ્રભાવશાળી અવાજ થી વ્યક્ત કરશો. સમાજ ના પ્રસિદ્ધ અને પ્રખ્યાત લોકો તમારી સાથે સંપર્ક માં આવશે. આ મેલ ને કારણે, તમારી પ્રતિષ્ઠા સમાજ માં વધારો કરશે. જો તમે સંપાદન, લેખન અને સાહિત્ય ક્ષેત્ર ના છો, તો આ સમયગાળા દરમિયાન તમને સારા પરિણામો મળશે.

પારિવારિક જીવન

કૌટુંબિક જીવન સુખી રહેશે. તેઓ જીવન ના સુખમય ક્ષણો નો આનંદ માણશે. પોતાના ધર્મ અને માતા પિતા થી વિપરીત જયીને તમે કોઈ કામ કરશો નહીં. દાન ના કાર્ય માં તમારી રુચિ વધુ હશે. આ સમયગાળા માં તમે ભૌતિક આનંદ માણશો. તમે આ સમયગાળા દરમિયાન જાત્રા પણ જઈ શકો છો. તમારી ઉદારતા અને નમ્રતા ને કારણે લોકો તમને માન આપશે

વિવાહિત અને પ્રેમ જીવન

પ્રેમ-સંબંધ માટે આદર્શ સ્થિતિ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે પ્રિય સાથે સારો સમય ગાળશો અને તેમની સાથે ક્યાંક ફરવા જાવી શકો છો. વૈવાહિક જીવન પણ મજબૂત કરવા માં આવશે. જીવનસાથી સાથે નો સંબંધ મીઠી અને મધુર રહેશે. જીવન ભાગીદાર દ્વારા તમે સમાજ માં સન્માન અને આદર મેળવશો.

આરોગ્ય

આ સમયગાળા દરમિયાન તમારું આરોગ્ય અનુકૂળ રહેશે. તમે તંદુરસ્ત અને ઉર્જાવાન થશો. જો તમે લાંબા સમય થી સ્વાસ્થ્ય સમસ્યાઓ થી પીડાતા હોવ તો આ સમયગાળા દરમિયાન તમને આરોગ્ય લાભો થવા ની સંભાવના છે. તંદુરસ્ત રહેવા માટે સંતુલિત જીવનશૈલી અપનાવો.

આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ

શું કરો

- અન્ય લોકો માટે પ્રેરણા સ્ત્રોત બનો. હંમેશા ઉચ્ચ શિક્ષણ માટે પ્રયત્ન કરો.

શું ન કરો

- નાની વસ્તુઓ ને વધુ મહત્વ આપી ને વધારે વિચારો નહીં. ખોટી દિશા માં તમારા જ્ઞાન નો ઉપયોગ કરશો નહીં.

ઉપાય

- બુધવારે, લીલા રુમાલ માં 6 લીલી એલચી લપેટી રાખો અને તેને તમારી સાથે રાખો. કાંસા નું પાત્ર દાન આપો.

ઓગસ્ટ 02, 2025 - ઓગસ્ટ 23, 2025

આર્થિક જીવન

અચાનક સંજોગો તમને અનુકૂળ કરશે. કેટલાક વ્યવસાયિક સોદા તમને મોટું નાણાકીય લાભ મળશે. આ સમયે તમે વધુ રોકાણ કરશો અને આ બધા રોકાણ કામો તમારા માટે ફાયદાકારક સાબિત થશે, તેથી જો તમે રોકાણ કરવા ની યોજના બનાવી રહ્યા છો, તો તેને કુશળતા થી બનાવો.

કારકિર્દી

નોકરી માં આ સમયગાળા માં પ્રમોશન હોઈ શકે છે. આ ઉપરાંત પગાર, વૃદ્ધિ માટે મજબૂત સંભાવના હશે. વ્યાપાર પ્રવાસો થી તમને લાભ થશે. તમને નોકરી અને વ્યવસાય માં ઉચ્ચ અધિકારીઓ તરફ થી ટેકો મળશે. જો તમે વ્યવસાય કરો છો તો તમને મોટો ફાયદો થશે.

પારિવારિક જીવન

આ સમયગાળા માં, તમે તમારા કૌટુંબિક જીવન થી સંતુષ્ટ થશો. સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા માં વધારો થશે કૌટુંબિક જીવન માં, મોટા ભાઈબહેનો ભેગા થઈ જશે અને ઘર માં એકતા ના વાતાવરણ હોઈ શકે છે. માતા પિતા ના સ્વાસ્થ્ય ની કાળજી રાખો અને સારા કામ કરતા પહેલા તેમના આશીર્વાદ લો.

વિવાહિત અને પ્રેમ જીવન

આ સમય દરમિયાન વૈવાહિક જીવન માં મધુરતા વધશે. તમે જીવન ભાગીદાર સાથે સુખદ ક્ષણ ભોગવશો. તે જ સમયે, પ્રેમ ના સંબંધો માટે પણ આ સમય ખૂબ જ સારો રહેશે. તમે તમારા મન ની વાત તમારા પ્રેમ સાથી સાથે શેર કરી શકો છો. પ્રિયતમ તમારી લાગણીઓ સમજી શકશે.

આરોગ્ય

આ સમયગાળા માં તમને શારીરિક અને માનસિક આનંદ પ્રાપ્ત થશે. તમારું સ્વાસ્થ્ય જીવન સારું રહેશે અને તમે ઊર્જા થી ભરાઈ જશો. સારા આરોગ્ય ને કારણે, તમારી કાર્યક્ષમતા માં વધારો થશે. આ સમયે, તમે યોગ અને વ્યાયામ ને પ્રાથમિકતા આપશો.

આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ

શું કરો

- તમારા કાન ની સંભાળ રાખો. ભાઈ બહેનો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે સારો સંબંધ રાખો.

શું ન કરો

- તમારા બાળકો પ્રત્યે ની તમારી જવાબદારીઓ ને છૂટા પાડવા થી દૂર ન થાઓ. તમારી સામાજિક સ્થિતિ વધારવા અને લોકો નો મિત્ર બનવા નો પ્રયાસ કરો.

ઉપાય

- શરૂ ગણેશ ચતુર્થી નો ઉપવાસ રાખો અને ગણેશજી ને મોદક અર્પિત કરો. કાબરચીતરા કુતરા ને દૂધ અને રોટલી ખવડાવો.

ઓગસ્ટ 23, 2025 - સપ્ટેમ્બર 11, 2025

આર્થિક જીવન

સૂર્ય, સામાન્ય રીતે સપ્તમ ભાવ માં, મુશ્કેલીઓ ઉત્પન્ન કરે છે, તેથી આ સમય તમારા માટે પડકારો થી ભરપૂર હોઈ શકે છે. ધન હાનિ પણ ઉઠાવી પડી શકે છે. સૂર્યના આ ભાવ માં સ્થિત હોવાને કારણે, તમે કોઈ વાત વિશે ખૂબ ચિંતિત રહી શકો છો.

કારકિર્દી

સફળતા પ્રાપ્ત કરવા માટે, તમારે સખત મહેનત કરવી પડશે, તમને સફળતા મળી જશે પરંતુ કઠિન સંઘર્ષ પછી, તમને તે મળશે. જો તમે ભાગીદારી માં વ્યવસાય કરો છો, તો તમારો ભાગીદાર તમને નુકસાન પહોંચાડી શકે છે તેથી તેમને જરૂરિયાત થી વધારે વિશ્વાસ કરશો નહીં. આ ચિંતા કુટુંબ, નોકરી, વ્યવસાય અથવા શિક્ષણ થી સંબંધિત હોઈ શકે છે. આ સમયગાળા માં તણાવ અથવા તાણને બદલે મનન કરવું અને ધ્યાન કરવું વધુ સારું છે. ત્યાં સરકાર, શાસક પક્ષ અથવા સરકારી વિભાગો તરફથી સમસ્યાઓ હોઈ શકે છે.

પારિવારિક જીવન

સાતમા ભાવ માં સૂર્યની હાજરી તમને જરૂર કરતાં વધુ આત્મ-આદર આપે છે. પરિણામ એ છે કે, લોકો તમને અહંકારી સમજી લેશે, તેથી તમારી અહંકાર નું બલિદાન આપો. જો સંબંધીઓ વચ્ચે કંઈક વિવાદ હોય તો તેને ઉકેલવા માટે પહેલ કરો.

વિવાહિત અને પ્રેમ જીવન

સૂર્ય ની આ ભાવ માં સ્થિતિ વૈવાહિક જીવન માટે યોગ્ય ગણવા માં આવતી નથી, તેથી, જીવન ભાગીદાર સાથે મતભેદ પણ શક્ય છે. આ સમયગાળા માં, વૈવાહિક જીવન માં સંતુલન બનાવી રાખો. વિવાદ અથવા મતભેદ ના કિસ્સા માં સંયમ સાથે કામ કરો અને સંવાદ દ્વારા સમસ્યાઓ ને હલ કરો.

આરોગ્ય

તમને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ હોઈ શકે છે. તમને તાવ, માથા નો દુખાવો અથવા પિત્ત સંબંધી રોગો નું સામનો કરવો પડી શકે છે. આ સમયે તમારા સ્વાસ્થ્ય ની વિશેષ કાળજી લો. જો સ્વાસ્થ્ય ખરાબ હોય, તો ડૉક્ટર ની સલાહ પ્રમાણે સારવાર લો. આળસ નું બલિદાન કરી શારીરિક શરૂઆત પણ કરો.

આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ

શું કરો

- તમારા જીવનસાથી ને સંપૂર્ણ પણે સ્વીકારો. તમારા વ્યવસાય ભાગીદાર સાથે ઈમાનદારી રાખો.

શું ન કરો

- સ્વયં થી નિમ્ન સ્તર ના વ્યક્તિઓ નું તિરસ્કાર કરશો નહીં. નિરર્થક દલીલો ને વધવા ના દેશો.

ઉપાય

- રવિવારે લાલ કપડાં દાન કરો. પાણી માં લાલ કનેર ના ફૂલ મૂકો અને સ્નાન કરો.

સપ્ટેમ્બર 11, 2025 - ઑક્ટોબર 11, 2025

આર્થિક જીવન

ચંદ્ર ના સાતમા ભાવ માં સ્થિત હોવું સુખદ માનવા માં આવે છે. આ સમયગાળા દરમિયાન તમને મિલકત મળી શકે છે. ધંધા માં સોદા મોટા પૈસા ફાયદા થશે. ચંદ્ર ના પ્રભાવ સાથે ના સહેજ પ્રયત્નો માં, તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો. જો તમે વિદેશ માં જવા માગો છો, તો તમારી ઘરછા ફક્ત કેટલાક પ્રયત્નો થી જ થઈ શકો છે.

કારકિર્દી

આ સમયે તમે સમાજ ના સારા લોકો સાથે સંપર્ક માં રહેશો અને તેમની મદદ થી તમને ફાયદો થશે. જો તમે નોકરી કરી રહ્યા છો તો આ સંપર્કો ની સહાય થી તમને નવી નોકરી મળી શકે છે. જો તમે વ્યવસાયિક છો તો તમને આર્થિક ફાયદો થઈ શકે છે. ત્યાં દૂરસ્થ સ્થળો અથવા વિદેશમાં સારા સમાચાર મળશે. ચંદ્ર ના સાતમા ભાવ માં હોવા ને કારણે, તમે સારા લોકો માં ગણાશો. આ સમયગાળા દરમિયાન, તમે દરિયા માં થી સફર કરી શકો છો અથવા દરિયા ની કાંઠે પ્રવાસી સ્થળ ની મુલાકાત લઈ શકો છો. તમને તમારા વ્યવસાય માં સારી સફળતા મળશે.

પારિવારિક જીવન

તમારું કૌટુંબિક જીવન પણ સંતોષકારક રહેશે. આ સમયગાળા દરમિયાન, તમારા બાળકો ક્યાંક ફરવા જઈ શકે છે. તેઓ પણ તેમના વ્યાવસાયિક જીવન માં સફળતા મેળવી શકે છે. માતા-પિતા સારી તંદુરસ્તી ધરાવતા હશે અને તમને તેમની પાસેથી સહયોગ મળશે.

વિવાહિત અને પ્રેમ જીવન

જો તમે અવિવાહિત હોવ, તો આ સમયગાળા દરમિયાન લગ્ન થઈ શકે છે. તમારું ભાવિ જીવન સાથી ખૂબ જ ઘનિષ્ઠ હશે. તમને તમારા જીવનસાથી સાથે સારી મુસાફરી કરવા ની તક મળશે.

આરોગ્ય

શારિરીક રીતે તમે સંપૂર્ણપણે યોગ્ય રહેશો, જો કે તમારું મન થોડું રમતિયાળ રહી શકે છે. આ સમયગાળા માં, તમે તમારી અંદર નવી શક્તિ અનુભવશો, અને તમે તમારા ઉત્સાહ થી તમારા બધા કામ કરશો. તમારા સુધારેલા આરોગ્ય ની અસર તમારા કાર્ય અને પ્રકૃતિ માં જોવા મળશે. પરિણામ સ્વરૂપે, તમને સારા પરિણામો મળશે.

આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ

શું કરો

- તમારા જીવનસાથી નો આદર કરો. તમારી નિયમિતતા માં યોગ અને ધ્યાન ઉમેરો.

શું ન કરો

- કોઈ પણ સ્ત્રી નો અનાદર કરશો નહીં. પાણી સંબંધિત વ્યવસાય કરશો નહીં.

ઉપાય

- કોઈ મહિલા અનાથાશરૂમ મા દાન આપો. નિયમિત રીતે શરીર શિવ રુદ્રાભિષેક કરો.

ઓક્ટોબર 11, 2025 - નવેમ્બર 01, 2025

આર્થિક જીવન

આ સમયે તમારી આર્થિક બાજુ નબળી પડી શકે છે તેથી તમારે નાણાં ની દ્રષ્ટિએ સાવચેત રહેવું પડશે. મોટા નાણાકીય નિર્ણયો લેવા નું ટાળો. ધન વ્યવહાર માં સંપૂર્ણ સાવચેતી રાખો. ખર્ચવા માં આવેલી બાબતો માં નાણાકીય વ્યવસ્થાપન ની જરૂર પડશે. જો તમે આ સમયે તમારી આર્થિક બાજુ ને અવગણશો તો તમને નાણાં ની ખોટ થઈ શકે છે.

કારકિર્દી

નોકરી અને વ્યવસાય માં અપ્સ અને ડાઉન્સ હોઈ શકે છે. વરિષ્ઠ અધિકારીઓ ની અપેક્ષાઓ કરતા સહયોગ ઓછો હશે. કાયદા વિરુદ્ધ કોઈ કામ ન કરો. કાર્યસ્થળ માં સખત મહેનત થી ડરશો નહીં, કારણ કે ભવિષ્ય માં તમને સીધો લાભ મળશે. કોઈપણ પ્રકાર ના લોભ આવી ને ટૂંકા રસ્તા ના લો.

પારિવારિક જીવન

જો કૌટુંબિક જીવન વિશે વાત કરીએ, તો ઘર સાથે નો તમારો સંબંધ ખરાબ હોઈ શકે છે. ખાસ કરીને ભાઈ બહેનો સાથે કોઈપણ બાબત અંગે વિવાદ હોઈ શકે છે. તમારો ગુસ્સો સ્વભાવ માં વધી શકે છે. આ ઉપરાંત, તમારી વાણી માં કડવાશ પણ જોવા માં આવે છે, જે તમારા સંબંધો ને અન્ય લોકો સાથે વધુ ખરાબ બનાવી શકે છે. તેથી હંમેશાં પ્રેમ થી લોકો સાથે વાત કરો.

વિવાહિત અને પ્રેમ જીવન

તમારા વૈવાહિક જીવન માં મંગળ નો ખરાબ દેખાવ પણ હોઈ શકે છે, તેથી સાવચેત રહો. પ્રેમ અને વૈવાહિક જીવન માં થોડો દુઃખ છે. જો તમે લગ્ન કર્યા હોય તો તમારા સાસુ પક્ષ થી કેટલીક સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે. પ્રેમ જીવન માં પડકારો ચાલુ રહેશે. તમારા સંબંધ માં વિશ્વાસ રાખો અને તેમાં શાંતિ લાવવા નો પ્રયત્ન કરો.

આરોગ્ય

મંગળ ની આઠમા ઘર માં હાજરી તમારા માટે દુઃખદાયક બની શકે છે. તમારે આરોગ્ય વિશે પણ સાવચેત રહેવા ની જરૂર છે. આઠમા ઘર માં સ્થિત મંગળ તમને શારીરિક પીડા આપી શકે છે. આ સમયગાળા દરમિયાન, તમારા શરીર માં ખીલ અથવા કોઈપણ દા હોઈ શકે છે. આ સમયગાળા દરમિયાન, તમે ગુદા સંબંધિત તકલીફ પણ થયી શકે છે, તેથી મરચાં - મસાલા વાળા ખોરાક ને ટાળો.

આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ

શું કરો

- અંતરંગ સંબંધો માં ધીરજ નો પરિચય આપો. તમારા આરોગ્ય ની સંપૂર્ણ કાળજી લો.

શું ન કરો

- ખૂબ જ ગરમ પ્રકૃતિ નો ખોરાક ખાશો નહીં. અનૈતિક કાર્યો અથવા અનૈતિક આવક થી દૂર રહો.

ઉપાય

- તાંબા ના વાસણ દાન આપો. 11 પીપલ નાં પાંદડા પર રામ-રામ લખો અને હનુમાન જી પર માળા ચઢાવો.

નવેમ્બર 01, 2025 - ડિસેમ્બર 26, 2025

આર્થિક જીવન

નાણાકીય બાબતો માં તમને સારા પરિણામો મળવા ની સંભાવના છે. નોકરી અથવા ધંધા માં નફો પ્રાપ્ત કરવા ના પ્રયત્નો સફળ થશે. જો તમે લાંબા સમય સુધી સખત મહેનત કરી રહ્યા છો, તો આ સમયગાળા માં, તમને તમારા સખત મહેનત નાં ફળો નાણાં ના રૂપ માં મળશે.

કારકિર્દી

આ સમયે, તમારું મન કામ વિશે ઓછું લાગશે અને તમારા મન માં કોઈ મૂંઝવણ ની સ્થિતિ હોઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમે નોકરી પર જવા થી ડરી શકો છો. સાવચેત રહો, તમારા સાથીઓ તમને ઠગી શકે છે. ઉતાવળ માં અથવા હડબડી માં કોઈ કામ કરશો નહીં. આ ફક્ત તમને નુકસાન કરશે.

પારિવારિક જીવન

ઘરેલું જીવન સામાન્ય ગતિએ ચાલુ રહેશે, જો કે તમારે ઘર માં શાંતિ અને સુમેળ રાખવા માટે સંઘર્ષ કરવો પડશે. આ સમયગાળા માં, પિતા સાથે નો તમારો સંબંધ સારો રહેશે અને તેમના આશીર્વાદ સાથે, તમે પ્રગતિ ના માર્ગ પર આગળ વધશો. તેઓ દરેક પરિસ્થિતિ માં તમારી સાથે ઊભા રહેશે અને તમને માર્ગદર્શન આપશે.

વિવાહિત અને પ્રેમ જીવન

ધ્યાન માં રાખો કે આ સમયગાળા માં, વિપરીત લિંગ ના લોકો સાથે નો સંબંધ વધુ ખરાબ થઈ શકે છે. જો કે, વૈવાહિક જીવન માં, જીવનસાથી થી સંપૂર્ણ ભાગીદારી મળશે. બે વચ્ચે સારી સહજતા જોવા માં આવશે. પરંતુ નાની મુશ્કેલીઓ પણ હોઈ શકે છે. તમારા જીવનસાથી ના આરોગ્યની કાળજી લો.

આરોગ્ય

આ સમય દરમિયાન, ગુપ્ત રોગ ની સંભાવના છે, તેથી તમારા આરોગ્ય ની કાળજી રાખો. ઘર માં, પરિજનો ના આરોગ્ય માં ઘટાડો થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન, તમે થોડી ચિંતા કરી શકો છો. જો કે, પરિસ્થિતિ ટૂંક સમય માં સુધરશે અને તમને આરોગ્ય લાભ મળશે.

આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ

શું કરો

- તમારા ઘર ની છત નિયમિત રીતે સાફ રાખો. નિર્ણય લેતા પહેલા સમજદાર વ્યક્તિ ની સલાહ લો અને તેનું પાલન કરો.

શું ન કરો

- કોઈપણ વસ્તુ ને કોઈપણ થી મફત માં ન લો. આગળ વધવા ની તમારી ઇચ્છા માં કોઈ ખોટો માર્ગ પસંદ કરશો નહીં.

ઉપાય

- બાજરી લો અને જમીન પર મૂકો અને ભારે પદાર્થ સાથે દબાવો. દુર્વા ને સમિધા બનાવી ને હવન કરો.

ડિસેમ્બર 26, 2025 - ફેબ્રુઆરી 13, 2026

આર્થિક જીવન

તમે વેપાર / વ્યવસાય માં નફો મેળવી શકશો. તમારા સામાજિક ક્ષેત્ર માં વધારો થશે. મિત્રો અને શુભ ચિંતકો સંપૂર્ણ ટેકો આપશે. આ સમયગાળા માં, તમારી બધી યોજનાઓ પૂર્ણ થઈ જશે. આ સમયગાળા માં તમે શેરબજાર માં રોકાણ માં રસ દર્શાવી શકો છો અને તે તમને આર્થિક લાભો મળે તેવી શક્યતા છે. તમે તમારા જ્ઞાન, કુશળતા અને કલાત્મક ગુણો થી સફળ થશો.

કારકિર્દી

આ સમય તમારી કારકિર્દી માટે સારો રહેશે. આ સમયગાળા દરમિયાન તમારા માં તમારો આત્મવિશ્વાસ તમને સતત સફળ કરશે. તમને આદર અને પ્રતિષ્ઠા મળશે. જો તમે પ્રકાશન, સ્ક્રિપ્ટ લેખન અથવા પત્રકારત્વ ના ક્ષેત્ર ના છો, તો આ સમયે તમને એક સુવર્ણ તક મળશે. ઓફિસ માં વિવાદો ટાળો અને ઓફિસ ની રાજનીતિ નો ભાગ બનો નહીં.

પારિવારિક જીવન

શુભ માંગલિક કામ નું ઘર-કુટુંબ માં આયોજન થશે. આ સમયગાળા માં, તમે લાંબા સમય સુધી તમારા મન માં કંઈપણ રાખી શકશો નહીં. તમે તમારા વિચારો ને ઘર ના લોકો સાથે શેર કરશો. ઘર માં બાળક નો જન્મ થયી શકે છે. તમારી માતા ધાર્મિક અને દાન કાર્ય કરશે.

વિવાહિત અને પ્રેમ જીવન

જો તમે પરિણીત છો, તો તમે આ સમયગાળા દરમિયાન બાળકો ની બાબત થી આનંદ અને સુખ મેળવશો. આ ઉપરાંત, તમે તમારા જીવનસાથી તરફ થી લાભ પણ મેળવશો. આ સમય પ્રેમ પ્રસંગ ની બાબતો માટે પણ સારું છે. તમે તમારા પ્રિયજન અથવા તમારા જીવનસાથી ની નજીક આવશો.

આરોગ્ય

આ સમયગાળા દરમિયાન આરોગ્ય ની વધઘટ જોવા મળી શકે છે, તેથી સંતુલિત આહાર લો. ચરબી અને તૈલીય ખોરાક ટાળવું તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે. આ સમયે તમારું વજન વધશે, તેથી નિયમિત કસરત તમારા માટે ફાયદાકારક રહેશે.

આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ

શું કરો

- ગરીબ બાળકો અથવા કોઈ જરૂરિયાતમંદ લોકો ને શીખવવા માટે સમય કાઢો. તમારા બાળક ને બધા સંસ્કારો શીખવો.

શું ન કરો

- પ્રેમ સંબંધો માં ખૂબ આદર્શવાદી ના બનો. વધારે જુગાર અને શરત થી દૂર રહો.

ઉપાય

- પીળી દોરી માં તમારા કાંડા માં કાચા હળદર ની ગાંઠ બાંધી દો. તમારી ખિસ્સા માં પીળી રુમાલ રાખો.

ફેબ્રુઆરી 13, 2026 - એપ્રિલ 11, 2026

આર્થિક જીવન

આ સમયગાળા માં અમુક નાણાકીય સમસ્યાઓ હોઈ શકે છે. તેથી દરેક પરિસ્થિતિ નો સામનો કરવા તૈયાર રહો. નબળા આર્થિક બાજુ ને કારણે, તમે કમાણી માં ઘટાડો જોઈ શકો છો. આ સમયે પૈસા ના કિસ્સા માં જોખમો લેવા નું ટાળો, નહીં તો તમારી પાસે નાણાકીય ખોટ હોઈ શકે છે.

કારકિર્દી

આ સમયે તમારા કારકિર્દી માટે તે સરળ રહેશે નહીં, તેથી નોકરી અથવા વ્યવસાય વિશે સાવચેત રહો. આ સમયે વગર જોયે અને ઉતાવળ માં કોઈપણ દસ્તાવેજો પર સહી કરશો નહીં. જો તમે નવું સાહસ શરૂ કરવા માંગો છો, તો સૌ પ્રથમ તેના બધા પાસાઓ પર એક વાર અવલોકન કરો.

પારિવારિક જીવન

આ સમયે તમે તમારી કૌટુંબિક જવાબદારીઓ ને પરિપૂર્ણ કરવા માં અસહ્ય અનુભવશો. પરિવારો ની અપેક્ષાઓ તમારા દ્વારા પૂર્ણ થશે નહીં. આ સમયે ઘર માં મનદુખ થઈ શકે છે અને આ સમયે માતા પિતા ના સ્વાસ્થ્ય માં પણ ઘટાડો જોઈ શકે છે. બધા તાણ છોડી ને પરિવાર માં સુખ લાવવા નો પ્રયત્ન કરો. પરિવાર થી દૂર જવા ની પણ શક્યતા છે.

વિવાહિત અને પ્રેમ જીવન

આ સમયગાળો વૈવાહિક અને પ્રેમ જીવન બંને માટે થોડું પડકાર રૂપ બનશે. આ સમયે તમારે ધીરજપૂર્વક કામ કરવું જોઈએ અને તમારા સંબંધ ને મજબૂત કરવા માટે જરૂરી પગલાં લેવું જોઈએ. જીવન ભાગીદાર અથવા પ્રિયતમ ને સમજવા ની કોશિશ કરો અને તેમની જરૂરિયાતોને પૂર્ણ કરો.

આરોગ્ય

આ સમયે તમારું આરોગ્ય નબળું રહેશે કોઈક કારણોસર તમારા ખોરાક ની નિયમિતતા પણ અવ્યવસ્થિત હોઈ શકે છે, તેથી તમને સમયસર ખોરાક મેળવવા નું મુશ્કેલ લાગે છે અને તે તમારા સ્વાસ્થ્ય પર પણ અસર કરશે. આ કિસ્સા માં, તમારા આરોગ્ય ની વિશેષ કાળજી લો.

આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ

શું કરો

- જીવિકા ઉપાર્જન માટે તમારી વાણી નો ઉપયોગ કરો. તમારી તરફ મજબૂત બનો અને પોતાને માન આપો.

શું ન કરો

- વિચારી ને બોલો અને કોઈ ની લાગણીઓ ને નુકસાન ન કરો. લાગણી ઓ પ્રત્યે સંવેદનશીલ રહો અને ભૌતિક વસ્તુઓ ને વધુ મહત્વ આપશો નહીં.

ઉપાય

- સાંજ દરમિયાન સંપૂર્ણ કાળા ઉરદ નો દાન કરો. શરીર કૃષ્ણ ની ઉપાસના કરો.

એપ્રિલ 11, 2026 - જૂન 02, 2026

આર્થિક જીવન

છઠ્ઠા ઘર માં બુધ સામાન્ય રીતે પીડાદાયક હોય છે. બુધ અહીં સૂચવે છે કે આ સમયગાળા દરમિયાન તમારા ખર્ચ માં વધારો થશે, તેથી ખર્ચ ને નિયંત્રણ માં રાખવું વધુ સારું છે. વિરોધીઓ ની તરફેણ માં પડકાર મળી શકે છે અને તેઓ તમારી છબી ને નુકસાન પહોંચાડવા નો પ્રયાસ કરી શકે છે, તેથી તમારા દુશ્મનો થી સાવચેત રહેવા નો પ્રયાસ કરો. તમે સારા અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે પૈસા ખર્ચશો.

કારકિર્દી

કામ અને વ્યવસાય ના ક્ષેત્ર ની પરિસ્થિતિ માં સુધારો થશે, જો કે કામ નો બોજો વધશે, તેથી વધુ પડતા કામ ના ભાર ને લીધે વધારે તાણ ન લો. આ ઉપરાંત, નિર્ણયકાર્યો ટાળવા નો પ્રયાસ કરો. આ સમયગાળા માં વાણી નિયંત્રિત કરો. બીજાઓ ની ટીકા કરવા નું અને કડવી શબ્દો બોલવા નું ટાળો. આ સમય દરમિયાન મુસાફરી ટાળો. કારણ કે આ સમયે મુસાફરી કરવા ની અપેક્ષાઓ ખૂબ જ ઓછી છે. આ એક સારી વાત છે કે બુધ ના પ્રભાવ થી આ સમયે તમે સખત મહેનત ની સફળતા મેળવી શકો છો. જોકે આ સમયગાળા દરમિયાન લોકો સાથે વિવાદ હોઈ શકે છે, તેથી, ગોઠવણો કરવા ની જરૂર છે. આ સમયગાળા દરમિયાન તમને લેખન માં રસ હોઈ શકે છે. જો તમે લેખન અથવા પત્રકારત્વ માં સામેલ હોવ તો આ સમયગાળા દરમિયાન વધુ સારું કરશો.

પારિવારિક જીવન

કૌટુંબિક જીવન માં તાણ ઊભો થઈ શકે છે અને વિવાદ ઊભો થઈ શકે છે, તેથી થોડી ધીરજ સાથે કામ કરો. શક્ય હોય ત્યાં સુધી કુટુંબ માં બિન જરૂરી વિવાદો ટાળવા નો પ્રયાસ કરો. આ સમયગાળા દરમિયાન માતા પિતા નું આરોગ્ય સારું રહેશે.

વિવાહિત અને પ્રેમ જીવન

પ્રેમ જીવન નો સારો સમય હશે. આ સમય દરમિયાન તમે તમારા પ્રિયજન માટે ભેટ ખરીદી શકો છો. બીજી બાજુ, વૈવાહિક જીવન માં કેટલાક મતભેદો હોઈ શકે છે, તેથી ધીરજ સાથે કામ કરો અને જીવનસાથી સાથે ગાઢ સંબંધ જાળવવા નો પ્રયાસ કરો.

આરોગ્ય

આ સમયગાળા માં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ની સંભાવના છે, તેથી સ્વાસ્થ્ય ની બેદરકારી કરશો નહીં. ત્વચા અને સ્નાયુ તંત્ર થી સંબંધિત વિકૃતિઓ આવી શકે છે. આવી પરિસ્થિતિ માં તરત જ ડૉક્ટર નો સંપર્ક કરો.

આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ

શું કરો

- પોતાના આરોગ્ય ની ઘણી કાળજી રાખો. માસી, ફર્ફ, કાકી, બહેન વગેરે સાથે સરસ રહો.

શું ન કરો

- માનસિક ઉદાસી ની સ્થિતિ માં રહેવું ટાળો. અતિશય કામ ની આદતો થી બચો.

ઉપાય

- રોજિંદા ગાય માટે ઘાસ કાઢો. અપા માર્ગ ની લાકડી થી હવન કરો.

જૂન 02, 2026 - જૂન 23, 2026

આર્થિક જીવન

તમારા ખર્ચ માં અચાનક વધારો થવા ની સંભાવના છે. મુસાફરી અપેક્ષિત પરિણામો આપવા ની શક્યતા ઓછી છે. નાણાકીય ક્ષેત્રે આ સમયે જોખમી નિર્ણયો લેતા નહીં. પૈસા વિશે સાવચેત રહો કારણ કે તમને આ સમયે નાણાં ગુમાવવા ની શક્યતા છે. કમાણી માં ઘટાડો જોવા મળી શકે છે.

કારકિર્દી

આ સમયગાળા દરમિયાન તમને કારકિર્દી માં મિશર્ પરિણામ મળશે. જો કે, તમારું નસીબ અચાનક ચમકશે. આ સમય દરમિયાન કારકિર્દી માં તમારી પહોંચ વધશે. પરંતુ સફળતા પ્રાપ્ત કરવા માટે, તમારે સખત મહેનત કરવી પડશે. નિરાશ થવા ની જરૂર નથી, તમને સફળતા મળી જશે.

પારિવારિક જીવન

આ સમયે તમારી અહંકાર ઘર ની શાંતિ નું વિસર્જન કરી શકે છે. સંબંધીઓ સાથે ના તમારા સંબંધો કડવી હોઈ શકે છે. તમારા અહંકાર ને છોડી દો અને ઘર ના આદરિત સભ્યો નો આદર કરો. આ સમયે તમારા માતા-પિતાના સ્વાસ્થ્ય ને ધ્યાન માં રાખો. ભાઈઓ અને બહેનો થી કંઈક તકરાર થઈ શકે છે.

વિવાહિત અને પ્રેમ જીવન

દામ્પત્ય જીવન અથવા પ્રેમ જીવન માટે શુભ સમય નથી. પ્રેમિકા અથવા પત્ની સાથે વિવાદ ની શક્યતા છે. આ સમયગાળા માં, વૈવાહિક જીવન માં સંતુલન કરો. વિવાદ અથવા મતભેદ ના કિસ્સા માં વાતચીત દ્વારા સમસ્યા નું સમાધાન કરો.

આરોગ્ય

આ સમયે તમને માથા નો દુખાવો, તાવ અથવા પિત્ત સંબંધી સમસ્યાઓ હોઈ શકે છે. આવી પરિસ્થિતિ માં તમારા સ્વાસ્થ્ય નો ઉપચાર કરો. તમે કેતુ ના પ્રભાવ થી આળસુ થઈ શકો છો. શારિરીક રીતે તમે નરમ દેખાશો આ સમયે પ્રોટીન સમૃદ્ધ ખોરાક લો અને ખોરાક માં સલાડ લો. સવારે ઊઠો અને શારીરિક યોગ કસરત કરો.

આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ

શું કરો

- તમારા જીવનસાથી ને સમજવા નો પ્રયત્ન કરો. જનનાંગ સંબંધિત રોગો વિશે સાવધ રહો.

શું ન કરો

- તમારા જીવનસાથી ના ચરિત્ર પર બિનજરૂરી સંદેહ કરશો નહિ. ભાગીદારી માં વ્યવસાય કરવા નું ટાળો.

ઉપાય

- સવારે અને સાંજે ઘરે દરરોજ લોબાન ની ધૂપ સળગાવો. ભૈરવ મંદિર પર જાઓ અને કાળો રંગ નો દ્રવ્ય મૂકો.

જૂન 23, 2026 - ઓગસ્ટ 23, 2026

આર્થિક જીવન

આ સમયગાળા માં નાણાકીય કટોકટી નો સામનો કરવો પડી શકે છે. નાણાં ની અચાનક ખોટ થી સમસ્યા વધી શકે છે અથવા આવક ની સરખામણી માં ખર્ચ માં અચાનક વધારો થવા થી તમારું બજેટ વધુ ખરાબ થઈ શકે છે, તેથી આ સમયગાળા દરમિયાન નાણાં સંબંધિત બાબતો માં શાણપણ અને ધીરજ સાથે કામ કરવું વધુ સારું છે. બિનજરૂરી ખર્ચા ટાળો અને આર્થિક વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરો.

કારકિર્દી

નોકરી ની સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી છે. જો કે, પડકારો અગાઉ થી જ રહેશે. અતિશય કામ થી થાકી શકો છો. સફળતા મેળવવા માટે, સખત મહેનત અને સંઘર્ષ થશે. વિરોધ પક્ષ પર પ્રભુત્વ કરવા નો પ્રયત્ન કરશે. આ સમય દરમિયાન કેટલાક લોકો તમારી છબી ને નુકસાન પહોંચાડી શકે છે, તેથી સાવચેત રહો.

પારિવારિક જીવન

આ સમયગાળા દરમિયાન પરિવાર ના સભ્યો સાથે સારા સંબંધો ની ઓછી આશા છે. વિરોધ પક્ષ પ્રભાવશાળી રહી શકે છે. જો કે, આ સમયગાળા દરમિયાન, તમારા બાળકો પ્રગતિ કરશે. આ પરિસ્થિતિ તમારા પિતા ને સારા પરિણામ આપશે અને તેને એક પ્રતિષ્ઠિત પદ અપાવશે. આ સમયે તમારી માતા નું સ્વાસ્થ્ય પણ સારું રહેશે તેવી અપેક્ષા છે.

વિવાહિત અને પ્રેમ જીવન

પ્રેમ ની બાબતો માટે સારો સમય છે, પરંતુ તમારા પ્રિયતમ અને તમારા વિચારો વચ્ચે ના તફાવતો ને લીધે સમસ્યાઓ આવી શકે છે. જો તમે પરિણીત હો, તો તમારા જીવનસાથી માં મતભેદ હોવા ની સંભાવના છે, તેથી વિવાદ ના કિસ્સા માં વાતચીત દ્વારા મુદ્દા ને ઉકેલવા નો પ્રયાસ કરવો વધુ સારું રહેશે.

આરોગ્ય

આરોગ્ય - સંબંધિત વિકારો થી હેરાન થઈ શકો છો. આ સમયગાળા દરમિયાન, તમને આંખ અથવા પેશાબ ના વિકાર સાથે ની તકલીફ થઈ શકે છે. પરિવાર માં કોઈ વ્યક્તિ ની આરોગ્ય ની કટોકટી હોઈ શકે છે. આવી પરિસ્થિતિ માં તરત જ ડોક્ટર નો સંપર્ક કરો. કારણ કે થોડી બેદરકારી તમારા અને તમારા પરિવાર ના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે.

આ અવધિ દરમિયાન યાદ રાખવાની વસ્તુઓ

શું કરો

- વિરુદ્ધ લિંગ ના લોકો સાથે સુમેળ વર્તન જાળવી રાખો. જીવન માં પડકારો નો સામનો કરો.

શું ન કરો

- તમારા મિત્રો ને વધારે માનતા નહિ. તમારા જીવનસાથી સાથે લડશો નહીં.

ઉપાય

- રોજિંદા ગાય માટે ઘાસ કાઢો. ગૂલર ની લાકડી થી હવન કરો.

આવતા ૧૨ મહિનાઓ માં બનવાવાળા વિશેષ યોગો

હવે, અમે આ સમય દરમિયાન તમારા જન્માક્ષર માં બનતા કેટલાક ખાસ યોગ અને રાજ યોગ પર એક નજર નાખવા જઈ રહ્યા છીએ. આ યોગો તમારા જીવન માં હકારાત્મક શક્તિ નો પ્રવાહ વધારે છે અને સફળતા અને સમૃદ્ધિ મેળવવા આગળ વધવા માં તમારી સહાય કરે છે. આ સમયે તમે નીચે ના રાજ યોગો ના પ્રભાવ હેઠળ છો:

૧. દુર્ધરા યોગ

આ વર્ષે યોગ અસર સાથે, તમે સારા અને મોઢા વાહનો નો આનંદ માણશો

૨. ઉભયચરી યોગ

આ વર્ષે યોગ અસર થી તમે નસીબદાર અને જાણકાર બનશો

૩. સરળ વિપરીત રાજ યોગ

આ વર્ષે યોગ ની અસર થી તમે સ્વીકાર્ય અને પ્રગતિ પામશો


૪. પરાશરી રાજ યોગ

આ વર્ષે યોગ ની અસર થી, તમારા જીવનમાં સમૃદ્ધિ હશે

આ અવધિ ની મજબૂતી

જ્યારે જીવન ના વિવિધ પાસાઓ આવે ત્યારે દરેક સમય-સમય અલગ હોય છે. આપણે અત્યાર સુધી આવા ઘણા પાસાઓ વિશે ચર્ચા કરી છે. જ્યારે આપણે આ વિવિધ ઘટકો ને સંપૂર્ણ રૂપે જુએ છે, ત્યારે તે અમને એક વિસ્તૃત છવિ આપે છે અને આ સમય દરમિયાન વધુ સારા નિર્ણયો લેવામાં અમારી સહાય કરે છે. આ પ્રકાર નો પરિપ્રેક્ષ્ય આપણ ને વસ્તુઓ ને ઊંડાણપૂર્વક જોવા માટે સક્ષમ કરે છે અને અમને રેખાઓ વચ્ચે વાંચવા માટે પણ સજ્જ કરે છે. આને પૂર્ણ કરવા માટે, અમે એક અનન્ય અનુક્રમણિકા બનાવી છે જે બધું ધ્યાન માં લે છે અને તમને જણાવે છે કે આ સમય ગાળો કઈ રીતે તમારા માટે ઉત્પાદક અને સફળ રહેશે. ચાલો જોઈએ કે આ અનુક્રમણિકા શું બતાવે છે:

આ અવધિ ની મજબૂતી 70%



અમે આશા રાખીએ છીએ કે આ રિપોર્ટ માં આપવા માં આવેલી માહિતીએ પ્રગતિ ના માર્ગ પર આગળ વધવા માં તમને ઘણી મદદ કરશે અને તમને તમારા સપના અને હેતુઓ ને પ્રાપ્ત કરવા દેશે.

First Chat FREE

Get First Chat Free with Certified Astrologers

[Chat Now](#)





World's No. 1 Astrology Portal & App

વેબસાઇટ

<https://www.astrosage.com/>

Disclaimer

We want to make it clear that we put our best efforts in providing this report but any prediction that you receive from us is not to be considered as a substitute for advice, program, or treatment, that you would normally receive from a licensed professional such as a lawyer, doctor, psychiatrist, or financial adviser. Although we try our best to give you accurate calculations, we do not rule out the possibility of errors. The report is provided as-is and we provide no guarantees, implied warranties, or assurances of any kind, and will not be responsible for any interpretation made or use by the recipient of the information and data mentioned above. If you are not comfortable with this information, please do not use it. In case of any disputes, the court of law shall be the only courts of Agra, UP (India).